

Date: 07/09/2022

To,
Department of Corporate Services **BSE Limited**P. J. Towers, Dalal Street,
Mumbai-400 001, Maharashtra.

Sub: Newspaper publication of Notice of the 12<sup>th</sup> Annual General Meeting of the Company, Book Closure & e-Voting Information:

Scrip Code: 543522

Dear Sir/Madam,

Pursuant to the provisions of Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are pleased to enclose herewith a Newspaper copy of Notice of the 12<sup>th</sup> Annual General Meeting of the Company, Book Closure & e-Voting Information published in "Financial Express" (English) and "Gujarat Samachar" (Gujarati) newspaper dated 7<sup>th</sup> September, 2022.

Kindly take the same on your record and oblige.

Thanking you.

Yours faithfully,

For NANAVATI VENTURES LIMITED

PANKAJ PANDAV

Company Secretary & Compliance Officer

ACS No.: 62216

Encl.: As above

**RBL Bank Ltd.** 

**▼The Indian EXPRESS** 

get the inside information and get inside the information.

nform your opinion with investigative journalism.

For the Indian Intelligent. The Indian Express.



सेन्ट्रल ॲंड ऒइ र्रन्डिया सेन्ट्रल वॅंक ऑफ़ इंडिया Central Bank of India "CENTRAL" TO YOU SINCE 1911

**BRANCH: SSI AREA, JAMNAGAR** 

APPENDIX-IV [See Rule - 8 (1)]
POSSESSION NOTICE (For Immovable Property)

The undersigned being the Authorized Officer of Central bank of India under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of Powers conferred under Section 13 read with rule 3 of Security Interest (Enforcement) Rules 2002, issued demand notice/s dated 14.06.2022 calling upon the borrower Shri Ishwarbhai Dalubhai Falia and Manishbhai Ishwarbhai Falia (Borrower), to repay the amount mentioned in the notice being Rs. 5,27,778 /- (Five Lac Twenty Seven Thousand Seven Hundred Seventy Eight Only) plus interest within 60 days from the date of receipt of the said

The borrower's having failed to repay the amount, notice is hereby given to the Borrower/ and the public in general that the undersigned has taken possession of the properties described herein-below in exercise of powers conferred on him/her under Section 13 (4) of the said Act, read with the Rule 8 of the Security Interest (Enforcement

rules 2002 on this **2nd day of September of the year 2022**.

The Borrower/s in particular and the public in general are hereby cautioned not to deal with the property/ies and any dealing with the property/ies will be subject to the charge of Central Bank of India for an amount of Rs. 5,27,778 /- (Five Lac Twenty Seven Thousand Seven Hundred Seventy Eight Only) and interest thereon w.e.f 14.06.2022 (Amount deposited after issuing of Demand Notice U/Section 13(2) has

been given effect) The borrower's attention is invited to provisions of sub-section (8) of Section (13) of the Act in respect of the time available, to redeem the secured asse

**DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY** 

All the Piece and Parcel of Immovable Property situated at Shop No. 1, B/h Mahaveer Farsan Mart, Post office street, Hawai Chowk, City Survey No. 186/C/1 paiki, the premises in transaction admeasure total 11.22 Sq. Mtrs. area, within the local limits of Municipal Corporation of Jamnagar City. Boundaries:

Bounded on the North by : Survey No. 186 paiki Bounded on the South by : Road

Bounded on the East by : Survey No. 186 paiki Bounded on the West by : Survey No. 186 paiki

Date: 02:09.2022 Place: Jamnagar

Sd/- Authorised Officer, Central Bank Offindia

## **NANAVATI VENTURES LIMITED**

CIN: U51109GJ2010PLC061936 Reg. Office:S-414, OM Plaza, Adarsh App. Co. Op. Ho. Soc., Village: Vijalpor, Taluka: Jalalpore, Navsari-396445. Gujarat Contact: +91 9316691337 | Email: info@nventures.co.in | Website: www.nventures.co.in NOTICE OF THE 12™ ANNUAL GENERAL MEETING OF THE COMPANY.

**BOOK CLOSURE& E-VOTING INFORMATION** 

NOTICE is hereby given that the 12th Annual General Meeting of the Members of NANAVATI VENTURES LIMITED will be held on Thursday, the 29th September, 2022 at 12:30 p.m. through Video Conferencing ("VC") Other Audio-Visual Means ("OAVM"), to transact the businesses as mentioned in the Notice of the 12th Annual General Meeting sent along with the Explanatory Statement, Directors' Report, Auditor's Report and Audited Financial Statements of the Company for the financial year ended 31st March, 2022.

The Annual Report for the Financial Year 2021-22 containing the Notice has been sent on 5th September, 2022 to all the Members whose names appears on the Register of the Company as on 26th August, 2022. Please note that there will be no dispatch of physical copies of notices to the members of the Company as per MCA and SEB icruciars regarding relaxation granted for dispatch of physical copies. These documents are also available on the website of the Company and web-link of same is http://wnentures.co.in/Investors-Relations/Annual-Reports/Annual%20Report%202021-22.pdf, website of stock exchange i.e. BSE Limited at www.bseindia.com and on the website of Company's Registrar and Transfer Agent, KFin Technologies Limited at https://evoing.kintech.com/
Notice is further given that pursuant to the provisions of Section 91 of the Companies Act, 2013 read with applicable rules and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from 23rd September, 2022 to 29th September, 2022 (both days Inclusive).

Notice is further given that pursuant to Section 108 of the Companies Act, 2013, Rule 20 of the

Inclusive).

Notice is further given that pursuant to Section 108 of the Companies Act, 2013, Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the SEBI (Listing Obligations and Disciosure Requirements) Regulations, 2015, the Company is providing facility of "remote e-voting" by KFIn Technologies Limited, on all the Resolutions as set forth in the Notice. The details of remote e-voting are given below:

Notice. The details of remote e-voting are given below:

1)The remote e-voting will commence on Monday, 26th September, 2022 at 9:00 a.m. and end on Wednesday, 28th September, 2022 at 5:00 p.m. for all the shareholders, whether holding shares in physical form or in dematerialized form. The e-voting module shall be disabled by KF in Technologies Limited for voting there after. Remote e-voting shall not be allowed beyond the said date and time.

2)Any person, who acquires shares of the Company and becomes member of the Company after dispatch of the Notice of e-AGM and holding shares as on the cut-offdate i.e. Thursday, 22nd September, 2022, may obtain the User ID and Password by sending an e-mall request to evoting@kfintech.com or in the manners detailed in the AGM notice.

3)The members who have not cast their votes by remote e-voting can exercise their voting rights during the e-AGM.

3)The members who nave not case upon rocks by standard properties and during the e-AGM.

4)A member may participate in the e-AGM even after exercising his/her right to vote through remote e-voting, but shall not be allowed to vote again during the e-AGM.

5)Mr. Manish R. Patel, (COP: 9360) Practicing Company Secretary, Surat has been appointed as Scrutinizer to ascertain Voting process in a fair and transparent manner.

Detailed procedure/instruction for remote e-voting/e-voting/joining the AGM through VC/OAVM are provided in the Notice of the 12thAGM on the Company's website at

www.nventures.co.in.
In case of any query/grievance, Member may refer to the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the Downloads sections of the website https://evoting.kfintech.com/ or contact at toll free Phone No. 1-800-309-4001 or contact Mr. Raghu Veedha, KF in Technologies Limited, Selenlum Tower-B, Plot 31-32, Financial District, Nanakramguda, Serilingampally, Hyderabad - 500032, Telangana write to them at email: raghu.veedha@kfintech.com or evoting@kfintech.com

By Orders of the Board of Directors For, NANAVATI VENTURES LIMITED

Date: Sep. 05, 2022 Place : Navsari.

Sd/- PANKAJ PANDAV

Company Secretary & Compliance Officer - ACS No.: 62216 SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES Regional Stressed Assets Recovery Branch
Ahmedabad Region II, 2nd Floor, Dena Laxmi Bhavan,
Ashram Road, Navrangpura, Ahmedabad-380009.
Tele- 079 26594234, Email- sarahd@bankofbaroda.com
Tele- 079 26594234, Email- sarahd@bankofbaroda.com

Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 6 (2) & 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower (s), Mortgagor (s) and Guarantor (s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, possession of which has been taken by the Authorised Officer of Bank of Baroda, Secured Creditor, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" basis for recovery of dues in below mentioned account/s. The details of Borrower/s/Mortgagor/Guarantor/s/Secured Asset/s/Dues/Reserve Price/e-Auction date & Time, EMD and Bid Increase Amount are mentioned below-

Assessibates reserve i necre-Adedon date a filme, Ellis and bld increase Amount are mentioned below -						
Sr. No.	Name & address of Borrower/s /Guarantor/s	Give short description of the immovable property with known encumbrances, if any (Mortgaged by)	Total dues	1. Reserve Price 2. Earnest Money Deposit (EMD)— 3. Bid Increase Amount—		
	PULSE MILLS PVT. LTD. Proprietor: Shri Maru Govindbhai Hiralal	All that piece and parcel of Free Hold N.A. Land Plot No 1 of Survey No 859 Paikiland admeasuring about 1402 Sq. Mtrs bearing Kankrol Gram Panchayat House No 37 [Factory Building] and construction thereon within the limits of Kankrol Gram Panchayat Taluka Himmatnagar. Mortgagor Mr. Govind Hiralal Maru.	as per 13(2) notice under	Reserve Price : Rs. 205.00 Lacs EMD : Rs. 20.50 Lacs Bid Inc.: Rs. 1.00 Lacs		

Status of Possession : Physical Date & Time of E-Auction : 26.09.2022 From 14:00 P.M. to 18:00 P.M. perty Inspection date & Time : 20.09.2022 From 02:00 P.M. to 05:00 P.M

For detailed terms and conditions of sale, please refer/visit to the website link For https://www.bankofbaroda.in/e-auction.htm and https://ibapi.in. Also, prospective

bidders may contact the Authorised officer on Mobile 9687671985

Date: 06.09.2022 | Place: Ahmedabad Sd/- Authorized Officer, BANK OF BARODA

indianexpress.com



The Indian Express. For the Indian Intelligent. **♦ The Indian EXPRESS**

**RBL BANK LTD.** 

**E-AUCTION SALE NOTICE** 

REGISTERED OFFICE: 1st Lane, Shahupuri, Kolhapur-416001.

Registered Office: 1st Lane, Shahupuri, Kolhapur-416001.

National Office: 9th Floor, Techniplex Complex-1, Off. Veer Savarkar Flyover, Goregaon West, Mumbai-400062

Branch Office at: RBL Bank Ltd. "Umiya Nivas", Main Bazar, Village: Khambala, Taluka: Padadhari, Dist.: Rajkot (Guj.)

RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 ("SARFAESI ACT") READ WITH RULE 8(6) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002 ("RULES")

Notice is hereby given to the public in general and in particular to the Borrower, Guarantor (s) and Mortgagor (s) that the below described immovable properties mortgaged/charged (collectively referred as "Property") to RBL Bank Ltd. ("Secured Creditor/Bank"), the Symbolic Possession of which has been taken by the Authorised Officer of the Bank under section 13(4) & section 14 of the SARFAESI Act read with the Rules, as detailed hereunder, will be sold on "As is where is", "As is what is", "Whatever there is" and "Without Recourse Basis" on 17.08.2022, for recovery of the Bank's outstanding dues plus interest as detailed hereunder under Rules 8 and 9 of the Rules by inviting bids as per below e-

auction schedule: Brief Description of Parties, Outstanding dues and Property								
S. N	Name of the Borrower & Guarantor (s)	Details of Property(les) & Mortgagor	Amount as per Demand Notice Date of Demand	Inspection Date	Reserve Price EMD	Date/ Time of	of Bids	Name of Authorised Officer/
1 2 3 4 5	Guarantor (s)  Shree Vallabh Jwellers (Applicant) Gopal Hemantial Katkoria (Co-applicant) Vandanaben Gopalbhal Katkoria (Co-applicant) Jayagauri Himatial Katkoriya (Co-applicant) Paresh Hematial Katkoriya (Co-applicant) Address 1 to 5: Block No. 83 Prajijat Residency, Sadhuvasvani Road, Toplend Residency, University Road, Rajkot	& Mortgagor  Property No. 01 Property Owned By: Jayagauri Himatlal Katkorlya All the Piece and Parcel of Residential Tenanment on Northern Side Admeasuring of 81.94 Sq. Mirs. In the Society Known As "kailashnagar Co-operative Housing Society Limited" on Sub Plot No. 17-A, Palki Of Plot No. 17, at Survey No. 130-1/b Paiki Having City Survey No. 77/2 of Sheet No. 64 of Village Raiya, Rajkot - 360005 Towards East: Road, Towards South:	Date of Demand &Possession Notice under SARFAESI Act INR 1,18,82,302.80/- (Rupees One Crore Eighteen Lakhs Eighty Two Thousand Three Hundred Two and	Date and Time	Bid Increase Amount Reserve price: 65,00,000.00 (Rupees Sixty Five Lakhs Only) EMD: 10% of Reserve Price Bid Increase amount: 50,000.00 (Rupees Fifty	of e-Auction along with documents Er	of Bids along with documents	Phone No./ Email Id
6 7 8 9 10	360005 Shree Vallabh Jwellers (Applicant) Gopal Hemantial Katkoria (Co-applicant) Vandanaben Gopalbhal Katkoria (Co-applicant) Jayagauri Himatial Katkoriya (Co-applicant) Paresh Hematial Katkoriya (Co-applicant) Address 6 to 10:Plot No. 17-A, (North Side), Kailashnagar C.H.S.L. Behind Aakar Apartment, 150 Feet Ring Road, Rajkot 360007	Other Building of Plot No. 17-A, Towards West: Plot No. 18 Towards North: Plot No. 16 Property No. 02 Property Owned By: Vandanaben Gopalbhal Katkorla All the Piece and Parcel of Residential Tenanment No. 83 Admeasuring 74.60 Sq. Mtrs. In The Society Known as "Parijat Residency" on Plot No. 755, Survey No. 57/1, T.P. Scheme No. 4, Village Raiya, Rajkot - 360005 Towards East: 25 Feet Road, Towards South: Plot No. 82 Towards West: Plot No. 94 Towards North: Plot No. 84	Eighty Paisa Only) as on 02.06.2022 against  Demand notice dated 02.06.2022  Date of Possession Notice- 17.08.2022	between 11:00 a.m. to 2:00 p.m.	Thousand Only)  Reserve price: 69,00,000.00 (Rupees Sixty Nine Lakhs Only)  EMD: 10% of Reserve Price Bid Increase amount: 50,000.00 (Rupees Fifty Thousand Only)		Alpesh Shah/ 9825044697 Alpesh.Shah@rblbank.com	

Terms and Conditions:

The Indian EXPRESS — JOURNALISM OF COURAGE —

ndianexpress.com

choose substance over sensation.

Inform your opinion with credible journalism.

For the Indian Intelligent.

The Indian Express.

- 1. The E-Auction Sale will be online through e-auction portal. The interested bidders are advised to go through the detailed terms and conditions of auction available on the website of https://www.bankeauctions.com & https://www.rbibank.com/pdf-pages/news before submitting their bids and taking part in e-auction.
- It shall be the responsibility of the bidders to inspect and satisfy themselves about the Property and specification before submitting the bid.
- The interested bidders shall submit their EMD details and documents through Web Portal: https://www.bankeauctions.com (the user ID & Password can be obtained free of cost by registering name with https://www.bankeauctions.com/ through Login ID & Password. The EMD shall be payable through DD at RBL Bank Ltd. "Umiya Nivas", Main Bazar, Village: Khambala, Taluka: Padadhari, Dist.: Rajkot (Guj.) before 5:00 PM on or before 10.10.2022.
- Interested bidders may avail support/ online training on E-Auction from M/s. C1 India Pvt Ltd Contact No: 7291981124/25/26. Contact Person Mr. Hareesh Gowda Mob No: 09594597555, e-mail-id: hareesh.gowda@c1Indla.com and for any query in relation to Property, they may contact Mr. Alpesh Shah, Authorised Officer (Mob. No. 9825044697 email: Alpesh.Shah@rblbank.com)
- The Authorised Officer of the Bank reserves the right to accept or reject any or all bids, & / or to postpone/cancel the auction at any time without assigning any reason whatsoever and his decision in this regard shall be final and binding.
- The asset shall not be sold below reserve price.
- The EMD shall be refunded only after 02 Working days, without interest, if the bid is not successful.
- Time and manner of payment: (a) Payment of 25% inclusive of 10% of EMD of the sale amount on acceptance of the offer by the Bank on the same day of acceptance of offer or not later than next working day. (b) Balance within 15 days of the confirmation of sale by the Bank. (c) In case of default of payment, all amounts paid shall be forfeited, as per provisions of the SARFAESI Act, 2002 and SARFAESI Rules, as case may be. The above sale shall be subject to the final approval of Bank.
- 10. Interested parties are requested to verify/confirm the statutory and other dues like Sales/Property tax, Electricity dues, and society dues, from the respective departments/offices. The Bank does not undertake any responsibility of payment of above dues.
- 11. The particulars in respect of the Secured Assets specified herein above have been stated to the information of the undersigned who however shall not be responsible for any error, misstatement of omission in the said particulars. The prospective purchasers, tenders are therefore requested to check and confirm in their own interest these particulars and other details in respect of the Secured Assets before submitting tenders.
- 12. Sale is strictly subject to the terms and conditions incorporated in this advertisement and in the prescribed tender form. 13. The bidders / tenderers / offerers shall improve their further offers in multiples of Rs.50,000/- (Rupees Fifty Thousand Only).
- 14. The successful bidder/offerer shall bear all stamp duty, registration fees, and incidental expenses for getting sale certificate registered as applicable as per law.
- 15. The Authorised Officer has the absolute right to accept or reject the bid or adjourn / postpone / cancel the tender without assigning any reason thereof and also to modify any terms and conditions of this sale without any prior notice.

STATUTORY 15 DAYS SALE NOTICE UNDER THE SARFAESI ACT

The Borrower, Guarantor(s) and Mortgagor(s) are hereby notified to pay the aforementioned sum along with further interest thereon plus penal and other interest and amounts as per the Transaction Documents before the date of E-Auction failing which, the Property will be auctioned/sold to recover the outstanding dues. Date: 07.09.2022 **Authorised Office** 

Cholamandalam Investment & Finance Company Limited **Cholamandalam** REGISTERED OFFICE: Cholamandalam Investment & Finance Company Limited (CIFCL), Dare House 1st Floor, 2, NSC Bose Road, Chennai 600001 | CIN : L65993TN1978PLC007576.

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES

E-auction Sale Notice for Sale of immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower / Co-Borrower/ Mortgagor (s) that the below described immovable properties mortgaged to the Secured Creditor, the constructive/physical possession of which has been taken by the Authorised Officer of M/s. Cholamandalam Investment and Finance Company Limited the same shall be referred herein after as M/s. Cholamandalam Investment and Finance Company Limited . The Secured Assets will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" basis through E-Auction for recovery of amount mentioned in the table below along with further interest, cost, charges and expenses being due to RRFL viz. Secured Creditor.

It is hereby informed to General public that we are going to conduct public E-Auction through website https://sarfaesi.auctiontiger.net

Place: Ralkot

		Date & Amount as		Reserve Price	E-Auction Date and Time	
Ι.		per Demand Notice	U/s 13(2)  Descriptions of the property/Properties		EMD Submission	
S No		Date of Physical			Last Date & Time Inspection Date	
1"	. co- borrower, mortgagors	Possession and		Bid Increment	Place of Submission of Bids and Documents	
1		amount as on (Date)		Amount (In Rs.)		
1	X0HLSTR00002431983	22/01/2022	Flat No. 202 on the 2nd floor admeasuring 65.31 sq. mts. Built up	Rs. 2109000/-	11/10/2022, 11.00 am to 01.00 pm	
1	1.MAMLENDRA MANOJKUMAR TIWARI	Rs. 25,42,980/-	arca, Along with 29.89 sq. mts. undivided share in the Open Land & 3.33 s mts. undivided share in the land of C.O.P. in "Anjani Nandan Residency, Building No.A4", Situate at Revenuc Survey No.98, Block	Rs. 210900/-	10/10/2022 upto 5.00 pm (With unlimited extension of 5 min each)	
1	353,gujarat housing board, parvat garn, codadra surat chorvasi gujarat-395010			10,000/-	04/10/2022 and 05/10/2022	
1	2.SONIYATIWARI.		No. 99 admeasuring 7487 sq. mts., of Moje Village Saniya-Kande,	10,000/-	B-105, ICC Building, Near Kadiwala School,	
1	353,gujarat housing board, parvat gam, godadra, surat, choryasi, gujarat-395010.	Rs. 25,42,980/-	City of Surat. Boundaries as per sale deed.		Majura Gate, Ring Road, Surat, Gujarat 395002.	
2	X0HLSTR00002135579	24-01-2022	Plot No.: 31 admeasuring 18 X 40 i.e. 720 sq. feet i.e. 66.80 sq.	Rs. 1437600/-	11/10/2022, 11.00 am to 01.00 pm	
1	LALAJIBHAI JASAMATBHAI RATHOD  2. Jasmatbhai Valabhai rathod	Rs. 2356198/-	meters, along with 20.07 sq. meters undivided share in the land of Road & C.O.P. in "Gopnath Society", situated at Revenue Survey No.:	Rs. 143760/-	10/10/2022 upto 5.00 pm (With unlimited extension of 5 min each)	
1	2. Jayaben Jasmatbhai rathod	06/05/2022	352/4, Block No. 333 admeasuring 9275 sq. meters, of Moje Village	10,000/-	04/10/2022 and 05/10/2022	
1	3. Mukeshkumar jasamatbhai rathod	Rs. 2356198/-	Kamrej. Ta: Kamrej. Dist:surat,Boundaries as per sale deed.	10,000	B-105, ICC Building, Near Kadiwala School,	
L	All residing at :-89,tejendra park soc khodiya nagar road, varachha surat gujarat-395006				Majura Gate, Ring Road, Surat, Gujarat 395002.	
3	HL01BAO000021960	22/01/2022	BLOCK No.690 old R.S.NO.764/2 ADMEASURING AREA 9207.00	Rs. 22,27,500/-	11/10/2022, 11.00 am to 01.00 pm	
П	1.KALPESH BHARTHUJI THAKOR MAHAVIR COLONY SHIYABAUG,	Rs. 23,58,804/-	Sq. Mt. In which it is constructed in the name and style of "Ashoka Apartment and penthouse paikee tower I second Floor Flat no. 1-202	Rs. 2,22,750/-	10/10/2022 upto 5.00 pm (With unlimited extension of 5 min each)	
1	VADODARA, GUJARAT-390001 2.AARTI THAKOR	25/06/2022	admeasuring are 91.98 sq. Mt. And other common area 39.52 sq. Mt. Of moie bhavii ta and dist, vadodara".	10,000/-	04/10/2022 and 05/10/2022	
1	MAHAVIR COLONY SHIYABAUG,	Rs. 23,58,804/-	- Tormoje onayirta and dist. Vadodara .		No. 113, 114 & 115, 1st Floor, Center Point, Opp-Bank of Baroda, R.C.Dutt Road, Baroda -	
	VADODARA, GUJARAT-390001				390007.	
4	X0HLSTR00002066571 1SAJANBHAI MEPABHAI CHOSALA 557, krishna soc, kareligam,kadodara bardoli road,surat 394310 2.lilaben sajanbhai chosala 557, krishna soc, kareligam,kadodara	15/04/2021	All the piece an parcel of the property and thereon constructed	Rs. 13,16,200/-	11/10/2022, 11.00 am to 01.00 pm	
П		Rs. 30,60,876/-	building in, Plot No. 19, Bapa Sitaram Residency, Admeasuring 89.04 Sq.Mts, Along with Undivided share in road 29.38 Sq.Mtrs, Survey No. 268, Block No. 327 admeasuring 6421 Sq, Mts, Moje - Village - Jolva, Tal - Palsana - Dist - Surat. East - Society Road. West - Plot No. 152. North - Plot No. 166. South - Plot No. 164.	Rs. 131,620/-	10/10/2022 upto 5.00 pm (With unlimited extension of 5 min each)	
П		22/06/2022		10,000/-	04/10/2022 and 05/10/2022	
П		Rs. 30,60,876/-			B-105, ICC Building, Near Kadiwala School, Majura Gate, Ring Road, Surat, Gujarat 395002.	
L	bardoli road,surat 394310				majura date, rving road, durat, dujarat 300002.	
5	HL04SUD000014694 1.KIRAN CHOHLA	21/06/2021	All the piece an parcel of the property and thereon constructed building in, Plot No. 29, Land admeasuring 117.50 S.Mtr, with house	Rs. 20,84,100/-	28/09/2022, 11.00 am to 01.00 pm 27/09/2022 upto 5.00 pm	
1	2.VALIBEN GABHRUBHAI SOHALA.	Rs. 21,90,812/-	there on, bearing Botad Revenue Survey no. 626/1 paiki situated at	Rs. 2,08,410/-	(With unlimited extension of 5 min each)	
1	All residing at :- Bhavnagar, Chitra, Gariadhar	26/05/2022	Botad, Taluka - Botad, Dist - Botad. within Municipal Limits of Botad Municipality and belonging to Sabhad Jabuben Sevabhai, East - Mt.	10,000/-	22/09/2022 and 23/09/2022	
П	Bhavnagar Indranagar, Darbargadh, Bhavnagar Gujarat-364001	Rs. 21.90.812/- 10 this side 7.50 Mt Wide Road, West - Mt. 10 this side Lag		901, Sakar II, Ellisbridge, Ahmedabad – 380009 (Plot no.522/3, TPS No.3, Ellisbridge,		
1		• • • • • • • • • • • • • • • • • • • •	PlotNo.14, North - Mt. 10 this sideLagu Plot no.30, South - Mt. 10 this side Plot No. 28.		Ahmedabad) - 380009.	
6	X0HLMES00002162563  1, AMRATBHAI SARTANBHAI DESAI, 20- Rayaka Nagar Nr Megha Bungalow Palanpur	30/07/2021	All the piece an parcel of the property bearing, As per Mortgage -	Rs. 11,85,000/-	28/09/2022, 11.00 am to 01.00 pm	
		Rs. 20,64,477/-	Northan Part, of Plot No.19P, Raykanager , B/H Megha Bunglow, Which is situated in Survey No-513p, of Palanpur Sim, Taluka -	Rs. 1,18,500/-	27/09/2022 upto 5.00 pm (With unlimited extension of 5 min each)	
	Banaskantha Gujarat-385001.	12/03/2022	Palanpur, District - Banaskantha. Admeasuring 600 Sq.Ft, 55.735	10,000/-	22/09/2022 and 23/09/2022	
	Mrs.BHIKHIBEN DESAI     Payaka Nagar Nr Megha Bungalow Palanpur     Banaskantha Gujarat-385001	Rs. 20,64,477/-	Sq.Mtr, East - 20 Ft Wide Road, West - Property of Plot no.24, North - Common Plot, South - Common wall of Plot No 19 paiki wall.		901, Sakar II, Ellisbridge, Ahmedabad – 380009	
L		NS. 20,04,411/	Common tot, County Common Wall of Floring 13 pain Wall.		(Plot no.522/3, TPS No.3, Ellisbridge, Ahmedabad) - 380009.	
7	X0HLBAO00002359060	29-11-2021	All the piece an parcel of the immovable property bearing All the piece an parcel of the property bearing, As per Mortgage - All the piece an	Rs. 8,50,000/-	28/09/2022, 11.00 am to 01.00 pm	
	1.CHANDAN.SHYAMKUMAR BHAVSAR, 741, Gokul Nagargotri Road, Vadodara, Vadodara, Gujarat-390021.	NUAN.ST YAMNUMAK BHAVSAK, Rs. 23,01,312/- Parcel of Admeasu 390021.  Rs. 23,01,312/- 24/03/2022 Admeasu Admeas	parcel of the property C. S. No. 1561, 1562 Paikee North side total	Rs. 85,000/-	27/09/2022 upto 5.00 pm (With unlimited extension of 5 min each)	
			Admeasuring 1801.00 Sq. Mt. In which it is constructed in the name and style Shreeji Flats Paikee Second floor Flat No. 204	10,000/-	22/09/2022 and 23/09/2022	
	2.SANGITABEN SHYAMKUMAR BHAVSAR	Rs. 23,01,312/-	Admeasuring area 70.14 Sq. Mt. and Other common are 14.07 Sq.		Office No. 113, 114 & 115, 1st Floor, Center	
	741, Gokul Nagargotri Road, Vadodara, Vadodara , Guiarat-390021		Mt. area of Moje Vadsar Ta, and Dist. Vadodara. Boundaries: East;Margin Area, West;Flat No. 207, North;Flat No. 205, South;Flat		Point, Opp-Bank of Baroda, R.C.Dutt Road,	
		East:Margin Area, West:Flat No.		at		
			17012001			

- 1. All Interested participants / bidders are requested to visit the website https://sarfaesi.auctiontiger.net & https://www.cholamandalam.com/Auction-Notices.aspx . For details, help, procedure and online training on e-auction, prospective bidders may contact M/s. e-Procurement Technologies Ltd.; Contact Mr. Ram Sharma Contact number: 8000023297/079-61813 6803. email id: ramprasad@auctiontiger.net, support@auctiontiger.net
- 2. The E-Auction sale of Secured Asset is on "as is where is". "as is what is". "whatever there is" and "no recourse" basis for and on behalf of the Secured Creditor viz. M/s.Cholamandalam Investment and Finance Company Limited and there is no known encumbrance which exists on the said property.
- For participating in online e-auction sale, Bid document, copies of PAN Card, Board Resolution in case of Company and photo ID, address proof are required to be submitted along with EMD, which is payable by way of DEMAND DRAFT M/s.Cholamandalam Investment and Finance Company Limited, Further The bidder is required to Hand Over the DD to Branch Manager
- All Interested participants / bidders are requested to visit the website https://sarfaesi.auctiontiger.net & https://www.cholamandalam.com for further details including Terms & Conditions, to take part in e-auction sale proceeding and are also advised to contact Mr. Sambhaji D. Patil. Contact Number 93775 83775 and e-mail sambhajidp@chola.murugappa.com and Mr. Mehul R. Kevadiya. Contact Number 87589 73050 and e-mail kevadiyamr@chola.murugappa.com. The successful Bidder will be required to deposit 25% of the sale price (including the EMD already deposited) on the same day or not later than next working day of the acceptance of Bid. The balance amount of the sale price is to be paid within
- 15 days of the confirmation of the sale. In case of failure to deposit the balance amount within the prescribed period, the amount of EMD and/or deposited amount shall stand forfeited and no claim shall be entertained against CSFB in respec
- The secured asset mentioned above is presently in the Physical possession of the Authorised Officer of M/s. Cholamandalam Investment and Finance Company Limited (AO). On conclusion of the e-auction sale and on receipt of the entire sale consideration, the possession of the Secured Assets shall be arranged to be handed over to the successful bidder by the AO M/s. Cholamandalam Investment and Finance Company Limited.

Note: Other Detail Terms and Conditions of the e-Auction will be made available on https://sarfaesi.auctiontiger.net

THIS IS ALSO A STATUTORY 30 DAYS SALE NOTICE UNDER RULE 8(6) OF SECURITY INTEREST (ENFORCEMENT) RULES.2002 **Authorized Officer** 

Place: Gujarat

Date: 07.09.2022

Ahmedabad

M/s.Cholamandalam Investment and Finance Company Limite

બુધવાર, તા.७ સપ્ટેમ્બર,૨૦૨૨

નવસારી : siગ : સંઘપ્રદેશના સમાચાર सुरत = તાપી વલસાડ = વાપી













જય કેસરકુંજ રેસીડેન્સી, બારડોલી | ગાંધીનગર સોસાયટી, બારડોલી

મરીમાતા મંદિર, બારડોલી

બહુચર મંડળ, સુથાર ફળિયા

તળાવ ફળિયું, કામરેજ

મોદી ફળિયું, કડોદરા

## દમણની હોટલોની નકલી વેબસાઇટ નવસારી જિલ્લામાં સાત દિવસીય વાપીમાં ગણેશ મંડપમાં જુગાર રમતા ૧૦ શખ્સ ઝડપાયા થકી છેતરપિંડી કરનારા ચાર પકડાયા

દમણ ખાતે આવેલી નામાંકિત પાંચી તધુ હોડ્ય સામલામાં પોલીસે રાજસ્થાનથી કેંગ ટોળકીના ચાર સ્મે રિસોર્ટના નામે નક્ક્રી લેગેસાઈટ બનારી પારંટકો અમેળીદ્યાન ગોળી પાંચી આપોપી પાસેથી અને રિસોર્ટના નામે નક્ક્રી લેગેસાઈટ બનારી પારંટકો અમેળીદ્યા ૧૦ ડીઉંગ્ટ અને કેકિટ કાર્ડ, બેંક પાસબુક, પાસેલી બુકિંગના કુલ રૂ.1.1.2 લાખ પડાવી લેવાના ચેક્રબુક સ્થિતનો મુદ્રામાંબા જ સ્થ્રો હતો.

### પોલીસે મોબાઇલ નંબર, ટેકનિકલ સર્વેલન્સ અને બેંક ખાતાના આધારે ૧.૧૮ લાખ પડાવનાર ટોળકીને રાજસ્થાનથી ઝડપી લીધી

ભકાન પણ 6ગાઇ કરતાં હતાં દમણ પોલીને તુષ્કર્વાનથી પડેલા ચાર આરોપી પૈકી આદિક ખાન યુ ટ્યુષ્ઠ સ્ત્રેત શ્રાઇ છે, જેના શકી લોકોને લોને અપાવવાની લોભામણી. લાલ્ય આપતો હતો. આરોપી પવન પંત્રે ખાતા ખોલવતો હતો. જ્યારે સાહિલ અને સોયબ લોકો પાસેથી પંત્રના દરતાવેજ એક્તિક કરી આરિકો આપતા હતા. આ 5 મોલી કહ્યાં લીં અને પ્રોલેક્ટ્રોનથી લોકોને શિક્ષક બનાવતા હતા. લાલ્ય આપી લીન અપાવવાના બહાને અનેક લોકો પાસેથી નાજાં પત્રની ઉત્તરપિંડી કરી હતી.

આધારે ૧.૧૮ લાખ પડાવનાર ટોળકીને રાજસ્થાનથી ઝડપી લીધી કરવા ખતે અલેલી નામારિત જેવી હોટલ સંચાહે તપાશ કરતા. કેટનેડલ સર્વેલ્લનના આપરે સભ્ય હોટલ એ રિસ્ટોર્લન નામ તેમ કહી તો સાઇટ બનાવી બેજબાજોએ એનલાઇન નાસો પડાવના બેલિક કર્યું હોક્ય કરી હતી. એક એનલાઇન નાસો પડાવના બેલિક કર્યું હતા. આ એક કપ્સ અને સિસ્ટોર્સ એનલાઇન નાસો પડાવના બેલિક કર્યું હતા. આ એક કપ્સ અને સિસ્ટોર્સ એનલાઇન હોલ્ય હતા. આ એક કપ્સ અને સિસ્ટોર્સ એનલાઇન સાધ્યમ્ય સાધ્યમ અંગે કપ્સ પડાવાલીઓએ મેનેજરને વેલસાઇટ પોલીસમાં કરિયાદ નોધારી હતી. આ શરૂ રૂપનું બુક્કિ કહારી ઓનલાઇન સાધ્યમ સાધ્યમ કરીયાદ નોધારી હતી. આ સ્પર્ય સ્થાર્ય હતા કર્યું હતા. પોલીસમાં અપાય તેમ સાધ્યમ સાધ્ય

# દિહેણ ગામે ડૉક્ટરના ફાર્મ હાઉસમાંથી

અભિનવ ચોક્સી પરિવાર સાથે વીક એન્ડ હોમમાં રહેવા જતા હતા. વીક વિજેશી અભિનવના પિતા ભિમલભાઈ વીક ! નોંધી તપાસ શરૂ કરી છે.

પાંચ એસી યુનિટ, વોલ કેનની ચોરી મુસ્ત થોડાલે, પંચવાર મન હોગતી દેખરેખ માટે શોસાપટીમાં સુસ્ત થોડાકો. સો. ઉપર આવેલી રેસ્તા લિકાલ કિંદ મુખાનેને જણાવેલું ખેતા પાજળના ભાગે બેઠ્યાના કારના પંચાય તે કેમ હોગ મો પાંચ કર્યું હોમ તે કરે કેમ તે હોગ મો બેઠ્યાના કારના અભિન લિકાલ કિંદ મુખાનેને જણાવેલી હોમ કર્યા કરે કેમ હોગ મો બેઠ્યાના કારના બેઠ્યાના માના માના માના માના કારના બેઠ્યાના કારના બેઠ્યાના કારના બેઠ્યાના કારના કારના બેઠ્યાના કારના કાર કારના કારના કારના કારના ક પહેલાં. 'હોટ લીધા બાદ એ વર્ષથી પહેલાં. 'હોટ લીધા બાદ એ વર્ષથી 'હોટમાં વીકએન્ડ હોમનું બાંધપ્રમ કરેલું છે. છેલ્લા એક મહિનાથી દર રવિવારે ફાર્મના સેક્ટરી સદેન ઠાક્ષેરે વીક એન્ડ બોકસીએ ઓલપાડ પોલીસમાં કરિયાદ

### વેચાણ અંગેની જાહેર નોટીસ

જીલ્લા સુરત, તાલુકા પલસાણા, મોજે વલેસા ખાતે આવેલ હસમુખખા પરંદભાઈ તથા પ્રફુલમાઈ મુખરેઈબાઈની સંયુક્ત માલિકીની લ્લોક નંખ 1૪ (સ. તં. ૪૨૧) વાળી હેક્ટર ૪-૫૨-૨૪ ચો.મી. માપવાળી ખેતી તોને મિલકત તેના માલિકે પોતાની માલિકી, કળજ, વહીવર, બોગવટા નાની જલાવી તથા મિલકતના ટાઈટલ ક્લીપર અને માર્ટેક્પલ હોવાન , બાવા આ જાકર પાટાસ વકા જાકદ જંપતાંમાં જણાં માં કોઈપછ વ્યક્તિ, બેંક, સોસાયટી યા સંસ્થાનો કોઈ , હક્ક, હિત, હિસ્સો, ઈંઝમેન્ટ, દરદાવો, ખોરાકી પ તો તેઓએ જરૂરી લેખિત દસ્તાવેજી પુરાવાઓ સાથે આ II દિન ૭ માં હમારા નીચે જણાવેલ સરનામે હમાં કાઇપલ જાત્યા લોવા નામ હકું . હસ્લા, સ્ટલ્સા યા પાત્રા પાત્રા હતા. તો તે જતા કરેલ છે તેવું માનીને હમારા અમેલિશ્રીના નામમાં અગર તો તે જ્યારે તે નામનો કારહું જમીનનો પાકો રજીસ્ટર્ડ વેચાણ કરતાહેજ કરા હૈશે. ત્યારઆદ કોઇની કોઈપણ પ્રકારની તર તકરાર ચાલશે નોંદે, જેની : જાતર નોટીશથી ક્લોએ નોંધ લેવી તા. *શોલ* રિગર ર

**ઠે.** ૬, કોળી સમાજ હિલ્કીંગ, લીમડા ચોક, બારડોલી. (૯૪૨૮૧-૪૪૦૪૫



દિવગીરી સહ જણાવવાનું કે અમાર માતૃક્રી **દિવાળીબેન નરોત્તમભાઇ પટેલ** દુ:ખદ અવસાન તા.૦૬-૦૯-૨૦૨૨ ને મંગળવારનાં રોજ થયેલ છે. લોકિક રિવાજ તથા બેસણું પ્રથા બંધ છે.

નરોત્તમભાઇ પટેલ

જાહેરમબરમાં જણાવેલી માહિતીની સત્યતા બાબતે અમો કોઇ બાંચેધરી एता नहीं वाहलों हो पोतानी होते ખાવતા હવા. વાવકાએ વાતાના રાત પૂરતી ચકાસલી કરીને ચોગ્ય નિર્ણય લેવાનો રહેશે.

- જાહેરખબર મેને જર



બારકોલી Liger Saala Crossbreed 10.00, 01.00, 04.00, 07.00, 09.30 Fakt Mahilao

> Mate (Gujarati) 12.00, 03.00, 06.00, 09.00

Ph:- 02622-230068 98791 333333

# ગૌરી ગણેશનું શાંતિપૂર્ણ વિસર્જન

નવસારી, મંગળવાર નવસારી જિલ્લામાં શ્રધ્ધા ભક્તિભાવ સાથે ચાલી રહેલા ગણેશોત્સવના સાતમા દિવસે ૩૦૦થી વધુ ગૌરી ગણેશ પ્રતિમાનું વિસર્જન કરાયું હતુ. અબીલ-ગુલાલની છોળો વચ્ચે યાત્રા નીકળી : વિરાવળ

અને ઉભરાટ-દાંડીના દરિયામાં ૩૦૦ પ્રતિમાનું વિસર્જન એનો ઉત્પરાટ - દાડાના દારયોમાં, 300 પ્રાંતમાનું ાવસજન ગહેશોત્વનની નવસારી જિલ્લામાં, છોવો હેઠાકી, ડો. જે.સાઇન્ડ સિસ્ટમાં ધામધૂમથી ક્રાયા બ્રાક્તિભાવ સાથે અને ગરબાની રમાઝર સાથે જિલ્લોક સ્લમમાં આવી રહી છે. આજે ''ગાલપીતાખા મોરીયા, પુરુષ વર્ષો સાત દિસ્સીય ગૌદી ગહેશની ભાવેક લવ્દરીયા'' ના માદ સાથે ગૂમી દેશ્યા બહતો દ્વારા આપી કરી. દિરાયભ પૂર્ણા નદીના હાત્રમાં આપી હતી. વિરાયભ દિસા કરાયા વિદાય આપી હતી. વિરાયભ દિસાય કર્યા દૃષ્ટા વિદાય આપી હતી. વિરાયભ દિસાય કર્યા હતું આ દંદીના દૃષ્ટિયા વિદાય અંગાય હતું અને દરમાં કર્યા પૂર્ણાનદીના ઓવારે અને ઇન્ડરાટન વિદાય કર્યા હતું કર્યા હતું માદ દૃષ્ટિયા કિનાર અંદાય હતું ઇન્ડરાટન વિદાય કર્યા હતું કર્યા હતું

સહ્યાં પ્રેપર અંભાલ ગુલાલના (સંસંજન કહ્યું હતું. વલસાડમાં ચાલતી ચોથી સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ વલસાડ, મંગળવાગ : રેક્ઝિ ઝેબલ ટેનિસ સેમ્પ્યનારીયનું વલસાડ નગરપાલિકાના તા. પમી થી તા. ૮મી સપ્ટેમ્બર સ્પોર્ટ્સ સેંક્સ ખાત ગુજતાત રામ્ય સુધી આયોજન કરવામાં આવું છે. અને વલસાડ સિંક્સિક્ટ એલ ટેનિસ પાત્ર પાત્ર પેલન્ટ ટેનિસ પેલાડીઓએ એસોસિએશન હારા ૪થી સ્ટેટ બાગ લીધો છે.



શોદી આપળારને **રા.૨૫૦૦૦/-** ઇનામ આપવામાં આવશે. જો વ્યક્સિને જોના મળે તો આ મોબાઇલ બંબર પર સંપર્ક કરવો Mo.9825815620, 8866282998, 9825437892

### નાણાવટી વેન્ચર્સ લિમીટેડ

CIN: U51109GJ2010PLC061936 રજી. ઓફિસ: એસ-કવર, ઓમ પ્લાઝા, આદર્શ એપાર્ટમેન્ટ, કો.ઓ.હા.સો. ગામઃ વિજલપોર, તા. જલાલપોર, નવસાટી-36ક8૪૫ – ગુજરાત Contact: 451 9316661337 | Email: info@mventures.co.in | Website: www.nventures.co.in इंपनीली ९२मी सामान्य सभा, हिसाली चीपडा लंड इत्या अन्ते ई-चोटींंगनी माहिली माहिली मोहेली लीटींस

અકભાવેલની દેશકેલા, પ્રાંથકાર કરિયારિ, સ્વીકાર વિધાર્ય માર્ગ વિધાર્ય જાયો પાર્ચ રહ્યા પણ દાના માર્ચ મા

મોડીમાં આવેલ કરવા મુખલ દર્શિક કરો પ્રાયુ કરા દારા-ર છે માનોઓ કોઇ-ને નહીંગે હતો વારે નથી આપ્યા તેઓ eAGM દરમીયાત્ર વોટ કર્યા કેટકો. મારી કરોક. \*\* કીચારે 6—વીટીને કરાવ એક સ્થાપ આપ પણ ક્ર-AGM માં લાગ વર્ષ કાશે પોર્ડ e-\*\* કોચારે 6—વીટીને કરાવ એક પાર્ચ આપ પણ ક્ર-AGM માં લાગ વર્ષ કાશે પોર્ડ e-\*\* મારે કાચારે કર્યા પાર્ટાસ લેખ તો માટે કરવામાં આવે છે. "મારે 6—વીટીને "AGM માતે અંદર્શ લેખ કેટ તેમાં આપે ક્રિક્ટ કર્યા મારે કર્યા કર્

બોર્ડ ઓફ ગ્રેરેક્ટર્સના હુકમથી નાશાવટી વેન્ચર્સ લિમીટેડ, વતી

સહી/– પંકજ પાંડવ કંપની સેક્રેટરી અને કંમ્પ્લાયન્સ ઓફીસ ACS No.: 62216 તારીખ: સપ્ટેમ્બર, ૦૫-૨૦૨૨

પાપાપા અંધારા માં અમત જું તેમાર દેવામાં ૧૦ દાવર ૧૦૦ ૧૦૦૧ વાળાં, મંગળવા ૧૦૦૦ મહેલા મંપમાં સમાતા પાનાના વાપીના ભડકમોરાયાં ગામેલા જુંગાર ૧૨ પોલીલે સોનવારે મચાતે ત્રિકે અન્યુ મહત્વ રિકે. સુલ્લા, ગાપી, મંદમાં અને સલવા ગામે મંદિરના લાપો માટી ૧૦ જુંગાનીને રોકલા અંદિર અન્યુ મહત્વ રહ્યા અને કર્યા ૧૦ જુંગાનીને રોકલા અંદિર અન્યુ માને આવેલા અને ૧૦૦૦ માને ૧૦૦૦ માને



1

### બરોડા ગુજરાત ગ્રામીણ બેંક

જિલ્લા કરાવ, વૃષ્યત રસાલ લા જે એક વર્ડા કરા માંગેલો રીજુથોનલ ઓફોસ : ત્રીજો માળ; આદિત્ય ચેપ્લર્સ, સ્ટેશન રોડ, વલસાડ-જોન નં. : ૦૨૬૩૨ – ૨૫૩૯૦, ૨૪૨૧૩૦.

8-651M વેચાણ નોટીસ

### સ્થાવર મિલકતની ઈ-હરાજી વેચાણ નોટીસ પરિશિષ્ટ -IV - એ (જુઓ નિયમ દ્(૨) અને ૮(૬) )

સિક્યોરીટી બન્દરેસ્ટ (જેન્ફોર્સિમ્ટ) નિયમો, ર૦૦ના નિયમ દ(ર) અને ૮(ડ) ની જોગ્યાવળી સાથે વાંચવા કિક ચોરિટાળીગામ અને ફિન્ક્સ્ટ્રનાન માંત્ર કાલાનાચીકલ કેન્દ્રેસ્ટરના અને એન્ફોરીએન્ટ ઓફ સેવ્યુલીટી મન્દ્રેસ્ટ એન્ટ ૨૦૦૨ હેઠળ સ્થાવન્દ્ર નિવક્તીના વેચાલ માટે લેન્દ્રસાર હેવાલ બોરિટ નાગી ખાત કરીને દેવાદાર (છે) વધા ખાનીબાડાર (છે) ભાગ ખાને બનાતો નો ટિસ આવામાં આવે છે કે નીચે જગાવેલ વંગમ અને સ્થાવર બિક્તાની રિક્સોર્ડ લેઇદારનો ગોડ)અર્પ કરાવેલ શે ખેતા કોક્સીક અથવા મોલિક કબ્બો બરોડા યુવરતા આમીલ બંદ્રેક, (ક્રાસ્ટોર્ડ લેકાદારના બાલિફ ત અધિકારોએ લાઇ છે, પેલું નીચે દર્શાલેલ એકાઈન્ટ્રાટીઓ વસુવતા માટે બચારી છે, 'મહે' બે છે 'મહે' ખેતે 'મે 'મહે' મહે' મહે 'મહે' મહો દર્શાલ મોલિક સામા કરવામાં આવી हार/भीरवेहार/पभीनहार, सिक्वोर्ड એસेट, सिक्वोर्ड वेखां, रिजर्व किंभत, ઈએમડी / ઈએમડी એકાઉલ્ટ नंजर, ज દુક્તિની રકમ/ સંપર્ક માટેની વ્યક્તિઓની વિગતો નીચે મુજબ છે.

.KS	કરજદાર / જામીનદારો / ગિરવેદારો ના નામ	સિક્થોર્ડ મિલકતની વિગતો અને	રિઝર્વ કિંમત / ઇ.એમ.ડી / ઇ.એમ.ડી ખાતા ન / સંપર્ક વ્યક્તિ / અધિકૃત અધિકારી	
d.	अने सरनामुं	સિક્યોર્ડ લોનની વિગતો		
٩	કરપદાર - શ્રી દિપક માધુભાઇ પોકલ	મિલકત તમામ ભાગ કે જે જિલ્લા નવસારી,જવાલપોર રોડ ગૌરીજંકર મોહલો માં આવેલ જમીન ટીકા નંબર, ૨૨ સિટી	(જાર પૂરા) ૨ . ૯૨,૦૦૦/-(રૂપિયા લાણું કજાર પુરા) દ:એમ.ડી તા રકમ જમા કરવાના ખાતા ન - ૩૦૯૪૦૦૧૫૬૧૦૨૦	
	રાવામું - ફ્લેટ નંબર ૩૦૧, બ્રહ્મા મહલ કોમલેક્સ, ગૌરીષેકર યો હલ્લો, પલાલપોર,નવસારી.	સર્વે નંબર ૪૪૩ (૨૭૫ ર૪ શો મીટર), રિટી સર્વે નંબર ૪૪૪ (૧૯ ૫૬ શે મીટર) અને સિટી સર્વે નંબર ૪૪૫ (૧૩૦.00 ચો મીટર) કુલ ૪૪૧.૩૦ ચો મીટર માં આવેલ લક્ષા મફલ કોમ્પલેકના ત્રીજો પાતા, ફુલેટ નંબર ૩૦૫ (૧૯ ૫ ચો. ઉટ્ટ) સદદ મિલકતા શ્રી શિયક માધુઆઈ પોકલ ના નામે ચાલી આદેલ છે.		
		૩૧/૦૮/૨૦૨૨ સુધી કુલ બાકી રકમ : રૂ. ૧૩,૦૧,૩૦૦/- વધા ત્યાર પછીનું ત્યાજ આકરિમક ખર્ચ, કોસ્ટ, ચાર્જ ઘગેરે.	संपर्ड व्यक्तित - स्त्री रमेश हे व्यास(म) - ६०६६००७०४२)	
9	કરવદાર - શ્રી કાંગ્રાઝભાઇ નિશારભાઇશેખ સરનામું -શ્ર-૧, સદાબદાર ઝેપાર્ટમેલ્ટ, કાપડિયા ચાવ, બેસર રોડ, વલસાડ-	ચો.ફટ છે. અને આશીર્વાદ કોમ્પ્લેક્સ માં આવેલ છે કે જે NA	રૂ. ૫,૧૧,૦૦૦/• (રૂપિટા પાંચ લાખ અબ્રિક ઇજાર પુરા)	
		વર્મીન સીટી સર્વે નંબર ફરર છે કે જેનું માપ ૩૪૦૮ ૪૮ ચો.મીટર છે અને તેના જૂનો સર્વે નંબર વદાવ-૨+૩ કે જેનું માપ ૩૩૩૬ ચો.મીટર છે અને જે વલસાડ નગરપાલિકા ઠદમાં, મોગરાવાડી ગામે.તાલકો અને જિલ્લો વલસાડ ખાતે આવેલ શ્રી છાવા સેખ	એક્સે પુરા) ઇ.એમ.ડી ના રકમ જમા કરવાના ખાતા નો	

			TOO COOL D'INDEDCOOK		
1		૩૧/૦૮/૨૦૨૨ સુધી કુલ બાકી ૨૭મ : ૨. ૧૩,૪૪,૯૦૦/- વર્ષા ત્યાર પછીલું વ્યાજ આકરિમક ખર્ચ, કોસ્ટ, ચાર્જ દગેરે.	जींड दाधारपाली २७भ - ३.५०००/- संपर्ड ट्यांडेल - औ क्षेत्र कोम जिणिते(मो- ६०६६:२०६०३०)		
કરવાર-શ્રી અમીર અલ્પક 3 કાર્ત્રીમાં સરત મું-(૧) ગ્રાઉન્ડ ફ્લોર ફુકાન નં. ૩૫, દ્વાનો સ્વેર મોલ, ડી-માર્ટ પાસે, ભાગેલ નાકા. વસદં આઓ રોડ વસાઇ વેસ્ટ), મહારાષ્ટ્ર. (૨) પ્લીટ નં. બી-વ-વ, એ ન એ ફસી ન ગર.	કરવદાર - શ્રી અમીર અહમદ કાર્ણમી	मिस्डवनो तमाम भाग थे सर्वे नंजर ६५/३/पी १/पी ९३, भेन. से. प्टोट नंजर ४९ (१०७८ ७० सो. मीटर) पैसी	इ. २४,७९,०००/- (३पिया बोदीस ला संकोतेर क्ष्मर पुरा)		
	ફલેટ નંબર બી-૧૦૩, પહેલા માળે , સાંઇ એવેન્યુ બિલ્ડિંગ 'બી' માં આવેલ, ડી- માટે પાતે, , વશીસર - અતુલ ચેડ, જિલા વલસાડ જેનું હુલ ક્ષેત્રફળ ૧૨૨૦ ચો. ફીટ્સ છે. આ મિલવલ થી અમીર અહંમદ કાર્ઝીમી ના અપો સાવી અમેલ છે.	હવાર એક્સો પુષ્ઠ) ઇ.એમ.ડી ના રકમ જમાં કરવાના ખાતા - ૩૦૯૫૦૦૧૫૧૬૧૦૨૦ IFSC CODE -BARBJEGGBXX બીડ વધારવાની રકમ - રૂ.૫૦૦૪/-			
		39/0૮/૨૦૨૨ સુધી કુલ બાકી ૨કમ : રૂ. ૪૦,૮૬,૫૦૦/-	संपर्क व्यक्तित - श्री कियान उन्नी हे पी(सं		

જર, કે વી રંગારેછી. બાદ, તેલગાગા, પિત્ર-

કરાયાર - લી કેલાનું માન વારા ક્રાયા માના કાર્યા હતા. લાખ ખન્યા. કરાયા કર્યા ક

ध-6राजुली वारीण अने समय : २१/०६/२०२२, मिखडवना निरीक्षणनी वारीण अने समय : २५/०६/२०२२ -----डे ०० की तमारे ०२ वाञ्चे हरम्यान सवारे ९२ थी खोरे ०४ वाञ्चे हरम्यान.

### વેચાણની વિગતવાર શરતો અને નિયમો માટે, કૃપા કરીને https://www.bggb.in નો સંદર્ભ લો सरङ्गेर्सी अधिनियम ,२००२ अंतर्गत स्टेटयूटरी १५ हिवसनी वेथाशनी नोटिस

ત્તરફુતા ભાગાતાના, રખજ ભાગાના વહનુવા . દેવાદારો (૧નોનાદાર) (ભેટવેદારો ને અત્રે નોડિસ ભાવામાં આવે છે કે કરાશુંની તારીન પહેલા યુરે પૂરી રકમ વ્હાપ અને વવેલ ખર્ચાનો સહીત સુકવી જવી, એમ નહિ કરવાથી મિક્કતો હરાશું ( વેચાર હરે મળે કોઈ બાદી રહેતું હશે તો તે ત્યાર ખર્ચા ખર્ચ કરાશે દેવાદારે) /તમીનાદારો (મિરકેલ રો પારેહી વસુલ કરવામાં આવશે. અધિકૃત અધિકારી

तारी**भ : ०७.०**६.२०२२ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક